



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૭/૦૧/૨૦૧૯ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૭૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૮ કેસ કરી, ૨૮ વ્યક્તિઓને ઝડપી, ૮૬ લીટર દેશી દારૂ કબજે કર્યો હતો.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૭૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૫૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૭૬/૧૯

વાડજ : માણેકભાઈ અનિલકુમાર ચૌધરી (ઉ.વ.૩૯)(રહે.બલ્ચુ આચરીસ આર.એફ.કંપની સામે એસ.પી.રીંગ રોડ વસ્ત્રાલ) એ તા.૨૬/૦૧/૨૦૧૯ નારોજ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૭/૧૨/૨૦૧૮ ના બે મહીના પહેલાના સમયગાળા દરમ્યાન યુનિયન બેંક અમદાવાદ ની આશ્રમ રોડ બ્રાન્ચ ના એ.ટી.એમ. તેમજ અન્ય અલગ-અલગ બ્રાન્ચના એ.ટી.એમ.માંથી આઠ થી દસ એ.ટી.એમ ધારકો (જેના નામ સરનામા જાણવા મળેલ નથી તે) નાઓ એ પૂર્વ આયોજીત કાવત્રા મુજબ એ.ટી.એમ.મશીનોમાં ટેમ્પરીંગ કરી કુલ રૂપિયા ૨૨,૦૫,૫૦૦/- ઉપાડી લીધેલ હોવા છતાં બેંક પાસેથી નાણા મેળવી લઈ બેંક સાથે છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી જે.એ.રાઠવા ચલાવે છે.

રખિયાલ : મોહમદઅહમદ મોહમદઝકીર શેખ (ઉ.વ.૩૨)(રહે.નસીબનગર અમનચોક વોરાની ચાલી પાસે બાપુનગર)એ તા.૨૬/૦૧/૨૦૧૯ નારોજ રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩/૧૨/૧૮ બપોરના ૦૨/૪૫ વાગ્યા પછી કોઇપણ સમયે રખિયાલ મોરારજી ચોક અરબ મસ્જીદની સામે કોઇ અજાણી વ્યક્તિએ મોહમદઅહમદ નાઓના બેંકના પુરાવા ડેટા વિગેરેનો ઉપયોગ કરી, તેમના બેંકના એકાઉન્ટમાંથી ટુકડે-ટુકડે કુલ રૂપિયા ૯૪,૯૦૨/- ઉપાડી લઈ મોહમદઅહમદ સાથે છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.જે.હળવદીયા ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૭૭/૧૯

સોલા હાઇકોર્ટ : શ્યામભાઈ કિશોરભાઈ ચાંપાનેરીયા (રહે.માલાબાર કાઉન્ટી-૧ નીરમા યુનિવર્સિટી પાછળ છારોડી) એ તા.૨૬/૧/૧૯ નારોજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૪/૦૧/૨૦૧૯ ના કલાક ૧૧/૦૦ થી તા.૨૫/૦૧/૧૯ બપોરના ૨/૦૦ દરમ્યાન પોતાના ઘરના મુખ્ય દરવાજાનું તાળુ ખોલી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તીજોરીમાંથી સોના-ચાંદી દાગીના કિંમત રૂપિયા ૧,૭૮,૦૦૦/- મતાના તથા રોકડ રૂપિયા ૭,૫૦૦/- મળી કુલ રૂપિયા ૧,૮૫,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.યુ.પાડવી ચલાવે છે.

સેટેલાઈટ : દિપકભાઈ હરગોવિંદભાઈ મહેતા (ઉ.વ.૬૪)(રહે.સુભાષનગર સેક્ટર ૮/એ ગાંધીધામ તા.જી.ભુજ-કચ્છ) એ તા.૨૬/૦૧/૨૦૧૯ નારોજ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૧૨/૨૦૧૮ ના કલાક ૧૨/૦૦ થી તા.૧૬/૧૨/૨૦૧૮ સવારના ૧૦/૦૦ સુધીના સમયગાળા દરમ્યાન રામદેવનગર ચાર રસ્તા. કોર્ટયાઈ મેરીયોટ હોટેલની પાછળ રુદ્ર પ્રયાગ ટાવર ૧૦ માં માળે એ/૧૦૦૨ ખાતે ધાબાની બારીથી અજાણી વ્યક્તિ અંદર પ્રવેશ કરી, દિવાલમાં લગાવેલ લોકરમાંથી (૧) સોનાની ચેઈન કિંમત રૂપિયા ૩૨,૦૦૦/- (૨) હિરા ઝડિત સોનાની વિંટીઓ નંગ-૨ કિંમત રૂપિયા ૮૦,૦૦૦/- (૩) લાકડાના કબાટમાંથી મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- (૪) સોની ડિજિટલ કેમેરો કિંમત રૂપિયા ૬,૦૦૦/- (૫) મંદિરમાંથી ચાંદીની બે મુતિઓ કિંમત રૂપિયા ૨,૦૦૦/- અને (૬) ચાંદીનું બ્રેસ્લેટ કિંમત રૂપિયા ૨૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૩૨,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.એન.સાધુ ચલાવે છે.

બાપુનગર : કાશ્મીરાબહેન ડો/ઓ છગનભાઈ ચૌધરી (ઉ.વ.૪૩)(રહે.વલ્લભ ફ્લેટ બાપુનગર ચાર રસ્તા બાપુનગર) એ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૦૧/૧૯ રાતના ૮/૩૦ થી તા.૨૬/૦૧/૧૯ ના કલાક ૬/૦૦ દરમ્યાન બાપુનગર ગુ.હા.બોર્ડ, બાપુનગર ચાર રસ્તા માસ્ટર એન્ડ સન્સ ની પાછળ આવેલ પોતાની ઓફીસના મુખ્ય દરવાજાનો નકુચો તોડી, અજાણી વ્યક્તિ ઓફીસમાં પ્રવેશ કરી, કોમ્પ્યુટર કિંમત રૂપિયા ૧૦,૦૦૦/-, LED ટી.વી. કિંમત રૂપિયા ૧૫,૦૦૦/- તથા રોકડ રૂપિયા ૧૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૪૦,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એમ.ગઢવી ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૭૮/૧૯

વસ્ત્રાપુર : વિરાજભાઈ પિયુશભાઈ ખત્રી (ઉ.વ.૨૧)(રહે.આમ્રકુંજ સોસાયટી સ્ટર્લીંગ પાસે ગુરુકુળ) એ તા.૨૬/૧/૧૯ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૩/૦૧/૨૦૧૯ બપોરના ૦૨/૦૦ થી સાંજના ૫/૦૦ દરમ્યાન પોતાના ફ્લેટના ખુલ્લા દરવાજે થી કોઈ અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, ઘરમાંથી લેપટોપ નંગ-૦૪ કુલ કિંમત રૂપિયા ૭૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી ભીખુસિંહ પ્રભાતસિંહ ચલાવે છે.

કાલુપુર : જોગીભાઈ ધર્મેશભાઈ કિષ્નાકાંત (ઉ.વ.૪૬)(રહે.જોગી કિષ્નાકાંત ઓપ હબીવાની શેરી, આર.જે.વોરાની વાડી દરવાજા ની અંદર, સિહોર ભાવનગર) તા.૨૬/૦૧/૨૦૧૯ બપોરના ૧/૧૫ થી ૪/૦૦ દરમ્યાન પાલડી એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડ થી વી.એસ.હોસ્પિટલ ની સામે સુધીની ઓટોરીક્ષા ની મુસાફરી દરમ્યાન ઓટોરીક્ષા નો ચાલક અને પાછળ બેસેલ ત્રણ અજાણી વ્યક્તિઓએ ભેગામળી જોગીભાઈની નજર ચુકવી તેમની ભેગમાંથી રોકડ રૂપિયા ૫૦,૦૦૦/- નજર ચુકવી કાઢી લીધા હતા. આ અંગેની ફરીયાદ જોગીભાઈ એ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી જયદીપસિંહ મહેંદ્રસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.